

(૭૫)

Fin. Exp (A'bad)

મકાલા, સોમવાર, તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦

ફાઇનાન્સિયલ એક્સપ્રેસ

3

૩૧/૮/૨૦



અન્ડ્ર્યુ યુલ એન્ડ કંપની લિમિટેડ

ANDREW YULE & COMPANY LIMITED
(A Government of India Enterprise)


CIN: L63090WB19900003229

8, Dr. Rajendra Prasad Sarani, Kolkata - 700 901

[Recruitment Advertisement No. 2020/02]

The Company is looking for candidates for General Division, Kolkata West Bengal to fill up the following position.

Sl. No.	Position & Grade	Qualification Required	Min. Post Qualification Exp.	No of Post	Grade & Scale Proposed	Max Age in years
1.	General Manager (Finance & Accounts)- (ET) / Dy. General Manager (Finance & Accounts)- (EB)	Chartered / Cost Accountant	18 / 15 years	1	E7 100000-260000 / E6 95000-240000	50 / 45

For details, refer to Company's Website @ <http://www.andrewyule.com/current-opening.php>નાનામવા રોડ શાખા : લીપ્પી આર્બિટ્રેટર હોલિંગ્સ, રાજકોટ, ગુજરાત.
નાનામવા રોડ, મેઈન રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨. ફોન : ૭૨૮૧-૨૩૬૦૭૭૩

કબજ નોટિસ (નિયમ-૮(૧) મુજબ)

આથી, નીચે સહી કરનાર બુનિયત બેંક ઓફ ઇન્ડિયા, (પૂર્વવત - આજના) નાનામવા રોડ શાખા, રાજકોટના અધિકૃત અધિકારી હોવાથી સિક્યુરીટાઇઝેશન એન્ડ રીફાઇન્સિંગ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ્સ, ૨૦૦૨ અને સિક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ની ૧૩(૧૨) અને નિયમ ૩ સાથે વાંચતા મંગેલ સત્તાની રૂએ તા. ૦૬.૧૦.૨૦૧૯ના રોજ ડિમાન્ડ નોટિસ પાઠવી, જેના ઉદ્ધારકતા સહેજ બી. ટેસાણી અને વેસાલી સહેજભાઈ ટેસાણીને નોટિસમાં દર્શાવેલ રકમ રૂ. ૭,૬૪,૨૩૨.૬૨ (રૂપિયા સાત લાખ ચોરાસું હજાર બસો બમીસ અને બાંસડ પૈસા પૂણ) આ માંગણા નોટિસ મળ્યાના ૬૦ દિવસમાં ચુકવી આપવા જણાવેલ હતું.

ઉદ્ધારકતા તથા જામીનદારો સદરહુ કુલ રકમ પરત ચુકવવામાં બિજાળ જતાં, ઉદ્ધારકતા અને જાહેર જનતાને નોટિસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનાર સદરહુ એકઠની કલમ ૧૩ની પેટા કલમ (૪) સાથે સરહેસી ઇન્વેસ્ટમેન્ટ નિયમ ૮ ને વંચાણે લઈને મંગેલી સત્તાની રૂએ તે/તેણીએ અધોસ્તાકારીએ નીચે વર્ણવેલી મિલકતને તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કબજે લીધેલ/મેળવેલ છે.

ઉદ્ધારકતા/ જામીનદારોને વિશેષરૂપથી અને જાહેર જનતાને આ મિલકત સાથે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવા સાથે ચેલવણી આપવામાં આવે છે અને જો વ્યવહાર કરશે તો તે બુનિયત બેંક ઓફ ઇન્ડિયા, નાનામવા રોડ શાખા, રાજકોટની તા. ૩૦.૦૯.૨૦૧૯થી લેણી રકમ રૂ. ૭,૬૪,૨૩૨.૬૨ (રૂપિયા સાત લાખ ચોરાસું હજાર બસો બમીસ અને બાંસડ પૈસા પૂણ) સાથે ત્યારપછીના ચકત વ્યાજ અને અન્ય ખર્ચા સહિતના બોજાને આધિન રહેશે.

ઉદ્ધારકતા/જામીનદારનું ધ્યાન દોરવામાં આવે છે કે, સદર કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ મુજબ સુરક્ષિત મિલકતને ઉપલબ્ધ સમયમાં મુકત કરી શકે છે.

રચાવર મિલકતનું વર્ણન

બધા ભાગ અને અંશ સહિતની રહેણાંક જમ્ના અને વિદ્યુત વ્યવસ્થી મિલકત : જે બ્લોક નં. ૨૦૩, આલ્ફા સીટી, ખીરસરા પેલેસ સામે, મેટ્રોડા જીઆઈડીસી પાછળ, લોહીકા રોડ, ડે. સ. નં. ૫૯ પેકી ૧, પ્લોટ નં. ૧૪૩ થી ૧૫૩ના સબ પ્લોટ નં. ૧૪૩ થી ૧૫૩/૨૦૩, ગામ : બલસરા, તા. લોહીકા, જી. સરકોટ ખાતે સ્થિત છે. જેની કુલ જમ્જાનું માપ ૪૮-૩૪ સે. મીટર છે તે સહેજ બી. ટેસાણી અને વેસાલી સહેજભાઈ ટેસાણી (મિલકતના માલિક)ના નામની છે.

તારીખ : ૨૮.૦૮.૨૦૨૦

સ્થળ : રાજકોટ

અધિકૃત અધિકારી,
બુનિયત બેંક ઓફ ઇન્ડિયા

AKSHAR SPINTEX LIMITED

CIN: L17291GJ2013PLC075677

૨૬૭, ઓડીસા : રેવેન્યુ સર્વે નં. ૧૦૨/૨, પેકી, પ્લોટ નં. - ૨

ગામ : હરીપર, રણુજા રોડ, તા. કાલાવડ, જામનગર - ૩૬૧૦૧૩ (ગુજરાત)

૭મી સાધારણ સભા ને લગતી નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે અસર સ્પીનટેક્સ લિમિટેડના સભ્યોની ૭મી વાર્ષિક સાધારણ સભા (એજન્ટ), તારીખ ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને મંગળવારે બપોરે ૪.૦૦ વાગ્યે, વિડિઓ કોન્ફરન્સિંગ ("વીસી") / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ ("ઓવીએમ") દ્વારા મળશે. જેમાં એજન્ટ નોટિસમાં દર્શાવ્યા મુજબ સામાન્ય તથા વિશેષ કાર્ય હાથ ધરાશે. સભ્યો ફક્ત વિડિઓ કોન્ફરન્સિંગ ("વીસી") / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ ("ઓવીએમ") સુવિધા દ્વારા એજન્ટમમાં જોડાઈ શકશે અને ભાગ લઈ શકશે.

કંપનીના સિનિયર ની સેગ્રેગેટ અને સિનિયર ઓફ કોર્પોરેટ અફેર્સ તથા નીચેના સિનિયર

S J CORPORATION LIMITED

CIN: L51900GJ1999PLC103450

Regd. Office : 311, 03rd Floor, Laxmi Enclave, Gajera School Road, Katargam, Surat- 395 004. TEL: 9904042992; Email: sjcorporation@yahoo.com; Web Site: www.sjcorp.in

NOTICE

For transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) This Notice is published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules) notified by the Ministry of Corporate Affairs effective from September 7, 2016 and subsequent amendments effective from February 28, 2017.

The Company has communicated to the concerned shareholders individually whose shares are liable to be transferred to IEPF and the full details of such shareholders are also made available on its website www.sjcorp.in.

Shareholders may also note that both the unclaimed dividend and the corresponding shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed back from IEPF after following the procedure in the Rules.

Concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original held by them for the purpose of transfer of shares to IEPF as per the Rules and upon such issue, the Company shall inform the depository by way of corporate action to convert the duplicate share certificates into DEMAT form and transfer in favour of IEPF. The original share certificate(s) which are registered in the name of original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Concerned shareholders holding shares in demat form may note that the Company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the DEMAT account of the IEPF.

In case the Company does not receive any communication from the concerned shareholders by Sep.30, 2020, the Company shall for complying with the requirements of the Rules, transfer the shares to IEPF by Sep.30, 2020. Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF pursuant to the said Rules.

For any queries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents viz. M/s Sharex Dynamic (India) Pvt Ltd, Unit: S.J Corporation Ltd, Unit C-101, 247 Park, L.B.S. Marg, Vikroli West, Mumbai - 400083. email id: support@sharexindia.com

Place: Surat

Date: 29-08-2020

For: S.J Corporation Limited

Deepa A.Dhamcha
Company Secretary

CAMEX LIMITED

CIN: L25111GJ1989PLC013041

Registered Office: Camex House, 2nd Floor, Stadium-Commerce Road, Navrangpura, Ahmedabad-380009.

Tel: +91-79-26462123, Fax: +91-79-26462260

Website: <http://www.camexltd.com>, Email: cs@camexltd.com

૩૧ મી વાર્ષિક સામાન્ય સભા માટે શેરદારકોને નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૩૧મી વાર્ષિક સામાન્ય સભા(AGM) સોમવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૦ ના રોજ બપોરે ૧:૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (VC)/ અન્ય ઓડિઓ વિડિઓ માધ્યમ (OAVM) દ્વારા મળશે. જે AGM નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના કાર્યકાર સારું મળશે.

કોવીડ-19 મહામારીના અંતર્ગત, ભારત સરકારે સિનિયર ઓફ કોર્પોરેટ અફેર્સના પરિપત્ર નં. 14/2020, તા. એપ્રિલ 8, 2020 પરિપત્ર નં. 17/2020, તા. એપ્રિલ 13, 2020 અને પરિપત્ર નં. 20/2020 તા. મે ૫, ૨૦૨૦ તથા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓર્ડર ઓફ ઇન્ડિયા ના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD/1/CIR/P/2020/79 તા. મે ૧૨, ૨૦૨૦ (પરિપત્ર) દ્વારા AGM કોઈપણ વ્યક્તિની પ્રત્યક્ષ હાજરી વિના માત્ર, VC/OAVM દ્વારા યોજવાની પરવાનગી આપેલ છે. આ પરિપત્રોના અંતર્ગત અને કંપની ધારા, ૨૦૧૩ અંતર્ગત પ્રાપ્યતા નિયમો અનુસાર તથા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓર્ડર ઓફ ઇન્ડિયા (વિદેશી) નો બિલ નં. ૨૨-૨૦ એન્ડ રિકલ્ડ ઓર્ડર રિકવાયરમેન્ટ્સ) નિયમો, 2015 ના પાલનમાં, કંપનીના સભ્યોની AGM VC/OAVM દ્વારા યોજાશે.

ઉપરાંત પરિપત્રોના અનુસંધાનમાં AGM ની નોટિસ તથા વાર્ષિક અહેવાલ 2019-20 જે સભ્યોના E-mail id કંપની ડિપોઝિટરી/ પાર્ટિસિપેન્ટ સમક્ષ નોંધાયેલ છે, તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવશે. સભ્યોએ નોંધ લેવી કે AGM ની નોટિસ તથા વાર્ષિક અહેવાલ 2019-20 કંપનીની વેબસાઇટ www.camexltd.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com તથા ઇ-વોટિંગની સુવિધા પુરી પાડનાર સંસ્થા સીટીએસએલ ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ હશે.

સભ્યો AGM માં ફક્ત VC/OAVM દ્વારા હાજર રહી શકશે અને ભાગ લઈ શકશે. AGM માં જોડાવાની વિગતો/ સુચનો AGM ની નોટિસમાં આપવામાં આવેલ છે. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અનુસાર, VC/OAVM દ્વારા જોડાયેલ સભ્યોને, કોરમની ગણતરી કરવામાં માન્ય ગણાશે.

કંપની દ્વારા તમામ સભ્યોને AGM ની નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ કારણો પર ઇલેક્ટ્રોનિક મત અપવા માટેની સુવિધા આપવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા AGM ની નોટિસમાં આપવામાં આવેલ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મત આપવા માટેની સુવિધા પણ AGM દરમિયાન કંપની દ્વારા આપાશે.

જે સભ્યોએ પોતાના E-mail id કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે નોંધાયેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા માટે તથા ઇલેક્ટ્રોનિક વોટિંગ માટેની લોગ-ઇન વિગતો માટે નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરવાનું રહેશે.

૧. જે સભ્યો ફિઝિકલ શેર ધરાવે છે : ફોનિયો નંબર, શેર સર્ટિફિકેટની સ્કેન કોપી (આગળ અને પાછળ), પાનકાર્ડ (સ્વ. પ્રમાણિત પાનકાર્ડની સ્કેન કોપી) અથવા કાર્ડ (સ્વ. પ્રમાણિત આધારકાર્ડની સ્કેન કોપી) વગેરે વિગતો કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ લીન્ક ઇન ટાઈમ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના E-mail id: ahmedabad@linkintime.co.in, mt.helpdesk@linkintime.co.in પર મોકલવી.
૨. જે સભ્યો ડિમેટ માધ્યમથી શેર ધરાવે છે તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે જોડાઈ E-mail id: ahmedabad@linkintime.co.in

fin. exp
(A'bad)
eng 3/18

MONDAY, AUGUST 31, 2020

5

INK LTD. ANDRA (E), MUMBAI- 400051

ies, 2002)
nancial assets and enforcement of security
ment) rules 2002 issued demand notices to
ists, charges and expenses till actual date of
notice is hereby given to the borrowers/co
ers conferred on him under section 13(4) of
cautioned not to deal with the properties and
street, costs and charges from the respective
secured assets.
e under, date of possession is given herein

TE OF POSSESSION MAND NOTICE DATE OUNT DUE IN RS.

08.2020
02.2016
6,08,862/-Rupees Six Lakhs Eight
and Eight Hundred Eighty Two Only / due
ayable as of 24.02.2016 with applicable
st from 25.02.2016 until payment in full.

FOR KOTAK MAHINDRA BANK LIMITED
AUTHORIZED OFFICER
020-67443107

KUBER UDYOG LIMITED

326, third Floor, Goldbrook Complex Opp Panseera,
Nr. Icon Arcade, C.G. Road, Ahmedabad 380009
CIN: L51909GJ1981PLC100824
Email id: kuberudyoglimited@gmail.com
Website: www.kuberudyog.com
Phone No. 75063 24443

NOTICE OF BOARD MEETING

Pursuant to Regulation 29 read with Regulation
47 of the Securities and Exchange Board of
India (Listing Obligations and Disclosure
Requirements) Regulations, 2015 (Listing
Regulations), Notice is hereby given that a
meeting of the Board of Directors of the
Company is scheduled to be held on Saturday,
September 05, 2020, inter alia, to consider
and approve the Un-Audited Financial
Results along with Limited Review Report for
the Quarter ended on June 30, 2020.
The said Notice may be accessed on the
Company's website at
<http://www.kuberudyog.com> and may also be
accessed on the Stock Exchange website at
<http://www.bseindia.com>.
Further, as communicated earlier, Pursuant
to "Code of Conduct to Regulate, Monitor and
Report Trading by Designated Person(s)" of
the Company and the SEBI (Prohibition of
Insider Trading) Regulations, 2015, as amended
from time to time the trading window of the
Company has been closed for all Designated
Persons and their immediate relative(s) from
Tuesday, July 01, 2020 till end of 48 hours
after declaration of financial results for the
quarter ended June 30, 2020.

For KUBER UDYOG LIMITED

Place: Mumbai
Date: 29/08/2020
Chetan Shinde
Managing Director
DIN:- 06996605

S J CORPORATION LIMITED

CIN : L51900GJ1981PLC103450
Regd. Office : 311, 03rd Floor, Laxmi Enclave, Gajera School Road, Katargam, Bhubai- 395
004, TEL: 9904042982; Email: sjcorporation9@yahoo.com; Web Site: www.sjcorp.in

NOTICE

For transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF)
This Notice is published pursuant to the provisions of Investor Education and Protection
Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules) notified
by the Ministry of Corporate Affairs effective from September 7, 2016 and subsequent amend-
ments effective from February 28, 2017.
The Company has communicated to the concerned shareholders individually whose shares
are liable to be transferred to IEPF and the full details of such shareholders are also made
available on its website www.sjcorp.in.
Shareholders may also note that both the unclaimed dividend and the corresponding shares
transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed
back from IEPF after following the procedure in the Rules.
Concerned shareholders holding shares in physical form and whose shares are liable to be
transferred to IEPF, may note that the Company would be issuing duplicate share certificate(s)
in lieu of the original held by them for the purpose of transfer of shares to IEPF as per the
Rules and upon such issue, the Company shall inform the depository by way of corporate
action to convert the duplicate share certificates into DEMAT form and transfer in favour of
IEPF. The original share certificate(s) which are registered in the name of original share-
holders will stand automatically cancelled and be deemed non-negotiable. Concerned
shareholders holding shares in demat form may note that the Company shall inform the
depository by way of corporate action for transfer of shares in favour of the DEMAT account
of the IEPF.
In case the Company does not receive any communication from the concerned sharehold-
ers by Sep 30, 2020, the Company shall for complying with the requirements of the Rules,
transfer the shares to IEPF by Sep 30, 2020. Please note that no claim shall lie against the
Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF pursuant
to the said Rules.
For any queries on the above matter, shareholders are requested to contact the Company's
Registrar and Share Transfer Agents viz. M/s Sharex Dynamic (India) Pvt Ltd, Unit: SJ
Corporation Ltd, Unit C-101, 247 Park, L.B.S. Marg, Vikrol West, Mumbai - 400083, email
id: support@sharexindia.com

Place: Surat
Date: 29-08-2020

For: SJ Corporation Limited
Deepa A.Dhamecha
Company Secretary

Union Bank of India

Ati Ayurvedic Hospital, Raj Nagar Chowk,
Kot - 360004, Tel No. 0281-2360773

NOTICE [Rule 8 (1)]

Authorised Officer of the Union Bank of
India, Rajkot under the Securitisation and
Enforcement of Security Interest Act, 2002
under section 13(12) read with rule 3 of the
2002 issued a demand notice dated 7th
Rakesh B. Desani & Vaishali Rakesh
in the notice being Rs. 7,94,232.62
toward Two Hundred And Thirty Two
thousand Two Hundred And Thirty Two
paise only from the date of receipt of the

ving failed to repay the total amount, notice
public in general that the undersigned has
erty described herein below in exercise of
n 13(4) of the said Act read with rule 8 of the
e year 2020.

and the public in general is hereby cautioned
ngs with the properties will be subject to the
ana Mava Road Branch, Rajkot for the
even Lacs Ninety Four Thousand Two
Sixty Two Paise Only) as on 30-09-2019

ed to provisions of sub-section (8) of section
ble to redeem the secured assets

IMMOVABLE PROPERTIES

Property Land and Building situated at
ace, Behind Metoda Gids, Lodhika Road,
No. 143 To 153/203 Of Plot No. 143 To 153
Admeasuring 48-34 Sq. Mt. Belonging To
wner Of The Property).

Authorised Officer,
Union Bank Of India



**Bandhan
Bank**

SALE NOTICE CUM INVITATION TO TENDER

This is to inform that GRUH Finance Limited (GRUH) by Order dated 18.09.2019 passed by the National
Company Law Tribunal (NCLT) Ahmedabad Bench and Order dated 27.09.2019 passed by NCLT,
Kolkata Bench merged into Bandhan Bank Limited (referred as "the Bank"). The effective date of the
merger was 17.10.2019. Therefore, pursuant to the aforesaid merger, the rights, liabilities
responsibilities and assets of GRUH has become the rights, liabilities, responsibilities and assets of
Bandhan Bank Limited (Bandhan Bank). Therefore, reference of Bandhan Bank in this Notice is deemed to
include GRUH Finance Ltd. prior to merger.

Sale Notice cum Invitation to Tender is hereby given to the public in general and in particular to the
Borrowers that the below described immovable property which is mortgaged to GRUH (Now "the
Bandhan Bank") is put for sale. The specific details of the properties, which are intended to be sold, are
enumerated hereunder in the SCHEDULE;

SCHEDULE

Name of Borrower(s), Account No., Date of Possession & Tender Reference No.	Description of the property to be sold (Secured Asset)	Secured Debt as on date of demand notice and as on 31.07.2020 (in Rs.)	Reserve price and EMD payable (in Rs.)
1. Mr. Vishal Jani	All that part and parcel of the immovable property situated at R.S. No. 486/1, T.P.	Rs. 1,42,874.60 as on 15.09.2015	Rs. 4,21,000/-
2. Mrs. Indiraben Hasmukhraj Jani	Scheme No. 119, Final Plot No. 128/1 Paiki, Sadhguru Sanidhya, Block No. D2, 5 th	Rs. 3,46,575/- as on 31.07.2020 which includes amount paid by the borrowers from the date of demand notice till date, if any, with further interest, costs, charges, etc.	EMD 10% of the offer price.
3. Mrs. Darshanaben Jatinkumar Vora	Floor, Flat No. 505, Nikol to S.P. Ring Road, Nikol, Ahmedabad admeasuring about 409 sq.ft. and undivided share of land being 148 sq.ft. and bounded by :		
4. Mrs. Sonalben Bharatkumar Trivedi	North : Open Space of 3 Meter		
5. Mrs. Rupaben Shaileshkumar Dave	East : Block No. C2 West : D2 - 504 Flat No South : D2 - 506 Flat No		
6. Mrs. Pallaviben Ruhikesh Pandya			
7. Mrs. Chetanaben Nitinkumar Pandya			
8. Mrs. Monaben Jigneshkumar Joshi (Sr. Nos. 2 to 8 in			

NTX LIMITED
2013PLC075677